

પેટનો-કમરનો દુખાવો.

- ❖ વાળના રોગો, નાની ઉંમરમાં ટાલ પડવી, ખોડો, માઈગ્રેન, ચક્કર આવવા, મોંઢામાં વારંવાર ચાંદા પડવા, પરસેવામાં વાસ આવવી...વગેરે.

હોમિયોપેથીક સારવાર ૧ દિવસના બાળકથી લઈને કોઈપણ ઉંમરની વ્યક્તિને આપી શકાય છે. બાળકોના રોગોમાં આ વૈજ્ઞાનિક સારવારે ખૂબજ ચમત્કારીક પરિણામો આપ્યા છે. માટે ખાસ કરીને બાળરોગોમાં એલોપેથીક સારવારની જગ્યાએ હોમિયોપેથીક સારવાર જ આપવી જોઈએ. અનુભવે એ જોયું છે કે જેને બાળપણમાં હોમિયોપેથીક સારવાર લીધી હોય છે તે ત્યારે તો રોગમુક્ત બને જ છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાના કારણે આગળ જતાં પણ તંદુરસ્ત જીવન જીવતા હોય છે અને વારંવાર બીમાર પડવાની શક્યતા નહીવત થાય છે. મેં મારી પ્રેક્ટીસમાં જોયું છે કે ૧૫-૧૭ વર્ષ પહેલા પૂરતા સમય માટે અથવા કોઈપણ બીમારીમાં હોમિયોપેથીક સારવાર લીધી હોય તેવા યુવાનો માનસિક અને શારિરીક રીતે આજે તંદુરસ્ત છે.

સૌથી મોટો ફાયદો એ છે કે દવા ગળી (મીઠી) હોવાના કારણે બાળક હોંશે હોંશે આ દવા લે છે. બાળક સામેથી મમ્મીને દવા આપવાનું યાદ કરાવે છે. બાળકોના રોગોમાં - તાવ, શરદી, ઝાડા, ઉલ્ટી, દાંત વખતની તકલીફ, પથારીમાં પેશાબ થવો, કરમીયા, ભૂખ ઓછી લાગવી, જમવામાં અરુચી, માટી-પેન ખાવા, જલ્દી થાકી જવું, શરીર ન વળવું, અભ્યાસમાં ધ્યાન ન રહેવું, ગુસ્સો, શરમાળપણુ, ડર લાગવો, અત્મવિશ્વાસ નો અભાવ, પરિક્ષા પહેલા નર્વસ થવું, શ્વાસ તથા એલર્જીના રોગો...

- ❖ એ ખોટી માન્યતા છે કે હોમિયોપેથીક દવા ધીમી અસર કરે છે.

તાવ, ઝાડા-ઉલ્ટી, દુખાવા જેવા રોગોમાં એ તુરન્ત પરિણામ આપે છે. હા, દર્દીનો રોગ ઘણા સમયથી શરીરમાં ઘર કરી ગયો હોય - હઠીલો થઈ ગયો હોય તો તેને સંપૂર્ણ મટાડવા માટે લાંબા સમયની સારવાર જરૂરી છે. રોગનો પ્રકાર, દર્દીની જીવનશૈલી, વારસાગત રોગ, દર્દીની ઉંમર વગેરે ઉપર સારવારનો સમય આધારીત હોય છે.